

(કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ અથવા સમાધાનથી માંડવાળ કરવા અંગે ગુજરાત રાજ્ય સહકારી મંડળીઓના રણસ્ટ્રોક્શીની કચેરીના પરિપત્ર)

ક્રમાંક : નસખ/૦૫/ત-૬/૨૪૩૨/સને : ૬૪
રણસ્ટ્રોક્શી, સહકારી મંડળીઓ,
ગુજરાત રાજ્ય, બ્લોક નં. ૧૦, પ્રથમ માલે,
ડૉ. લિલાબાઈ મહેતા ભવન,
ગાંધીનગર, તા. ૨૪/૨૫-૧૧-૬૪

પરિપત્ર

વંચાણે લીધા

૧. રણસ્ટ્રોક્શી, સહકારી મંડળીઓ, ગુજરાત સરકારી વિભાગના તારીખ ૪-૧૨-૬૭નો પરિપત્ર ક્રમાંક વહે/૦૬૬૭/બ-૩૬૧૧
૨. રણસ્ટ્રોક્શી, સહકારી મંડળીઓ, ગુજરાત ગાંધીનગરના તારીખ ૨૭-૧૧-૬૮નો પરિપત્ર ક્રમાંક નસખ/૧૦૭૧/બ/૩૨૬૧/૧૯૬૨
૩. રીજર્વ બેંક ઓફ ઇન્ડીયાનો તા. ૧૪-૬-૬૮નો પરિપત્ર ક્રમાંક : યુ.બી.ડી./આઇ.એમ.એલ./૨-એ/સે-૧/૬૩-૬૪

સહકારી સંસ્થાઓના બાકી લેણા માંડવાળ કરવા અંગે ઉપર ક્રમાંક ૧ થી વંચાણે લીધેલ પરિપત્રથી માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવી હતી. નાગરિક સહકારી બેંકોના બાકી લેણા માંડવાળ કરવા અંગે ઉપર ક્રમાંક : ૨ થી વંચાણે લીધેલ પરિપત્રથી બે કમિટીની રચના કરી બાકી લેણા માંડવાળ કરવા અંગે માર્ગદર્શક સુચનો બાહીર પાડવામાં આવ્યા હતા.

ગુજરાત સહકારી મંડળીના અધિનિયમ-૧૯૬૧ની કલમ-૬૬ની જોગવાઈ મુજબ ખરાબ અને શકમંદ લેણા માંડવાળ કરવા અથવા નુકશાની માંડવાળ કરવા અંગે નફામાંથી જોગવાઈ કરવાની હોય છે. વસુલ ન આવે તેવા લેણા અને નુકશાનીની આવી રકમ જોગવાઈની સામે માંડવાળ કરવાની રહે છે. સહકારી સંસ્થાઓના લેણાની વસુલાત બેતી વિષયક ધીરાણના ડિસ્સામાં અધિનિયમની કલમ-૧૦૬ અન્વયે અને અન્ય ડિસ્સાઓમાં અધિનિયમની કલમ-૬૬ની જોગવાઈ મુજબ લવાહી રાહે લુકમનામું મેળવી કલમ-૧૦૩ની જોગવાઈ અનુસાર વસુલ કરવાની રહે છે.

ઉપર પેરા-૧માં હરાંધ્યા મુજબ ખરાબ અને શકમંદ લેણા માંડવાળ કરવા કે નુકશાની માંડવાળ કરવા અંગે તે સબબની જોગવાઈ લક્ષમાં લઈ તે અંગેની કાર્યવાહી ને તે સહકારી સંસ્થાએ કરવાની રહે છે. નાગરિક સહકારી બેંકો દ્વારા જુદા જુદા હેતુઓ માટે ધીરાણ કરવામાં આવે છે. આ ધીરાણની વસુલાત આવે તે અંગે પુરતી કાળજી લેવામાં આવે છે. કાબુ બહારના સંલેગોને લીધે ધીરાણ મેળવનાર વ્યક્તિ ધીરાણ સમયસર ભરપાઈ કરવામાં નિઝફળ જય તો તેની સામે લવાહી કાર્યવાહી કરી વસુલાત કરવામાં આવે છે. આમ છતા કેટલાક ડિસ્સાઓમાં પુરેપુરી વસુલાત આવતી હોતી નથી. બાકી લેણા પેકી ને વસુલાત આવી ન હોય તે રકમ માંડવાળ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. સામાન્ય રીતે વસુલાત આવે તેમ ન હોય અને બાકી લેણા ખરાબ લેણા તરફ વર્ગિકૃત કરવામાં આવ્યા હોય તેવા લેણાને શકમંદ અને ખરાબલેણા ફંડની જોગવાઈ સામે માંડવાળ કરવાના રહે છે.

અનુભવે જણાયું છે કે વસુલ ન થઈ શકે તેવા બાકી લેણાની માંડવાળની કાર્યવાહી બેંકો પોતે કરે છે. આ અંગે કાયદાની કોઈ ચોક્કસ જોગવાઈ કે ધીરાણના ભાવે દેશ સંસ્થા પોતાને અનુરૂપ તેવી કાર્યપદ્ધતિને અનુસરે છે. એવા સંલેગોમાં ધીરાણ મેળવનારનું બાકી લેણા માંડવાળ કરવાની પરિસ્થિતિ ઉપસ્થિત થાય ત્યારે બાકી લેણા માંડવાળ કરવા અંગે બેંકના વ્યવસ્થાપક મંડળને અધિકાર હોવા જોઈએ તેવી રણ્ણઆત નાગરિક સહકારી બેંકના ફંડરેશન/એસોસીએશન તરફથી વારંવાર કરવામાં આવે છે. અગાઉ જણાયું છે તેમ ખરાબ અને શકમંદ લેણાના ફંડોની સામે માંડવાળ કરવાના રહે છે. પણ ઉપર જણાયું તેમ આ અંગે કેટલીક સંસ્થા પોતાને યોગ્ય લાગે તે પદ્ધતિ અનુસરે છે.

ઉપરોક્ત હકીકિતો લક્ષમાં લેતા ખરાબ અને જાની ગયેલ લેણા માંડવાળ કરવા અને સમાધાનના સ્વરૂપે બાકી રહેતા લેણા માંડવાળ કરવા અંગે માર્ગદર્શક સુચના નક્કી કરવા જરૂરી જણાય્યા છે.

નાગરિક સહકારી બેંકો લેણા માંડવાળ કરવાની ને પદ્ધતિ અનુસરે છે તે લક્ષમાં લઈ રીજર્વ બેંક ઓફ ઇન્ડીયાને તેના તારીખ ૧૪-૬-૬૮ના પરિપત્ર ક્રમાંક યુ.બી.ડી./આઇ.એમ.એલ./૨-એ/જે-૧/૬૩-૬૪ થી ખરાબ લેણા અને નુકશાનીને માંડવાળ કરવા માર્ગદર્શક સિદ્ધ્યાંત નક્કી કરેલ છે. આમ સહકારી કાયદાની જોગવાઈ તથા રીજર્વ બેંક ઓફ ઇન્ડીયાની સુચનાઓને લક્ષમાં લઈ રાજ્યની નાગરિક સહકારી બેંકો દ્વારા ખરાબ લેણા માંડવાળ કરવા અને બાકીદારો સામે સમાધાનના પરિણામે માંડવાળ કરેલ લેણા માંડી વાળવા નીચે દરાવેલ સુચનાઓ નક્કી કરવામાં આવે છે અને સુચનાઓનો અમલ કરવા ભારપૂર્વક અનુરોધ કરવામાં આવે છે.

- નમી ગયેલ અને ખરાબ લેણા જેને ખરાબ લેણા તરીકે વળ્ફિકૃત કરેલ હોય તેવા લેણાને ખરાબ લેણા ફરની જોગવાઈ સામે માંડવાળ કરવા.
- આ માંડવાળની કાર્યવાહી કરતી વખતે રીજર્વ બેંક ઓફ ઇન્ડીયાના તા. ૧૪-૬-૯૭ના પરિપત્રની જોગવાઈ અને સહકારી કાયદાની કલમ-૬૬ની જોગવાઈઓને લક્ષ્ય કરેલી.
- આવા લેણા માંડવાળ કરવાની મંજુરી સાધારણ સભા આપે પછી જ માંડવાળ કરી શકાયે.
- ખરાબ લેણા માંડવાળ કરતા પહેલા નાગરિક સહકારી બેંક જે લુણા મધ્યस્થ નાગરિક સહકારી બેંક સાથે નોડાયેલ હોય અને તેનું ધીરાણ મેળવેલ હોય તેની પૂર્વ પરવાનગી મેળવવી.
- નાગરિક સહકારી બેંક લુણા મધ્યસ્થ બેંક સાથે સંયોલુત થયેલ હોય પરંતુ ધીરાણ લીધેલ ન હોય તો અને બેંકનો છેખ્ખો ઓડીટ વર્ગ 'અ' અથવા 'બ' હોય તો તેવી નાગરિક સહકારી બેંકોના ખરાબ લેણા માંડવાળ કરતા પહેલા મધ્યસ્થ સહકારી બેંકની પૂર્વ પરવાનગી લેવાની જરૂરી નથી.
- લેણા માંડવાળ કરવા અંગે સાધારણ સભા મંજુરી આપે તે પછી જ તે અંગેનો હથાલો હિસાબીપત્રમાં નાંખવાનો રહેશે. આમ કર્યા અંગેની ખરાઈ ત્યાર પછીના વર્ષના ઓડીટ વખતે ઓડીટરે કરવાની રહેશે.
- વર્ષ દરમ્યાન માંડવાળ કરવામાં આવેલા બાકી લેણા અંગે અલગ રણસ્ટર રાખવાનું રહેશે.

સમાધાનના સંદર્ભમાં માંડવાળ :

નાગરિક સહકારી બેંકોએ કરેલ ધીરાણની સામે પુરતી નામીનગીરી લેવામાં આવતી હોય છે. સામાન્ય રીતે જે ધીરાણ કરેલ હોય તે વસુલ આવે તેમ છે, તે અંગે પુરતી કાળજી પણ લેવામાં આવે છે. તેમ છતા કેટલાક સંલેગોમાં ધીરાણ લેનારની આધિક પરિસ્થિતિ કથળી જતા તે ધીરાણની પુરેપુરી બાકી રકમ પરત કરવા અસમર્થ બને છે. વ્યાજ, દંડનીય વ્યાજ અને અન્ય ખર્ચાઓ ઉમેરતા બાકી રકમ ઘણી ઉચ્ચી હોય છે. લોન લેનાર વસુલાત આપવા માટે તૈયાર હોય છે. પરંતુ બાકી રકમ પુરેપુરી વસુલ આવે તેવી મિલ્કત તેની પાસે હોતી નથી. વ્યક્તિ તમામ મિલ્કતો વેચાણ કરી બાકી રકમ બરપાઈ કરવા તૈયાર હોય છે. આમ સમાધાનના પરિણામે બેંક કેટલીક રકમ માંડવાળ કરવી પડે છે. આ બાબતે પણ દરેક બેંક જુદી જુદી પદ્ધતિ અનુસરે છે. આવશ્યક કિસ્સાઓમાં સમાધાન કરવા અંગે પણ માર્ગદર્શક સુચનો જરૂરી જણાય છે. તે હકીકતે નીચે મુજબના ધોરણો નક્કી કરવામાં આવે છે.

- વર્ષ દરમ્યાન સમાધાનને પરિણામે માંડવાળ કરેલ રકમ શકમંદ/ખરાબ લેણા ફરના ૩૦% થી વધવી નોટીએ નહીં.
- સમાધાનની રકમમા મુદ્દા અને કરાર મુજબના વ્યાજમા દાખા તારીખ સુધીની રકમનો સમાવેશ કરવાનો રહેશે નહીં.
- કુલ બાકી રકમના ૨૦% થી વધુ રકમ સમાધાન કરી માફ કરવી નહીં.
- સમાધાન કરતા પહેલા બાકીદાર પાસે વસુલાત માટે કોઈ મિલ્કત નથી તેની ખરાઈ કરી જવાબદાર પાસેથી પ્રમાણપત્ર મેળવવાનું રહેશે.
- સમાધાન અંગેની અતિમ મંજુરી સાધારણ સભાની રહેશે. આ અંગે સાધારણ સભાના એજન્ડામા તેનો સમાવેશ કરવાનો રહેશે.
- સમાધાનને પરિણામે બેંક ગુમાવેલ રકમ નુકશાન તરીકે ગણી તે અંગેનો હથાલો તેના ફર ખાતે નાંખવાનો રહેશે.

બાકી લેણા માંડવાળ અને સમાધાનની કાર્યવાહી અંગે ઉપર જાણાવેલ માર્ગદર્શક સિદ્ધાંત/સૂચનાઓ ઉપરાંત રીજર્વ બેંકની વખતોવખતની સુચનાઓ પણ લક્ષ્યમાં લેવાની રહેશે. તેનો બંગ થયેથી બેંકના સંચાલક મંડળ/પદાધીકારી વ્યક્તિગત/સામુહિક રીતે જવાબદાર રહેશે.

વ્યક્તિ લેણા માંડવાળ કરવા અંગેના અગાઉ કરવામાં આવેલ રાજ્ય કક્ષાની બે સગિતિઓ સહિતના તમામ પરિપત્રો આચી રહ કરવામાં આવે છે.

સહી અવાચ્ય
રાજીસ્ટ્રાર સહકારી મંડળીએ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર